





માણસના મન-મગજ પર તેના કૌટુંબિક, સામાજિક, આર્થિક સંલેગોની ઉડી અસર પડતી હોય છે. તેને માનસિક બિમારી સમજ ઈલાજ કરાવો. તે માણસ ગાંડો કે ચક્કમ નથી. તેનું મગજ ફેદીલ થઈ ગયું છે એમ કહી તેને હડધૂત ના કરશો.

**વિષયસૂચિ :**

- |   |   |
|---|---|
| ૧.૦ આત્મ ગોરવ                                   | ૩.૪ તણાવથી થતાં શારીરિક ફેરફારો અને રોગો              |
| ૨.૦ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનાં સામાન્ય કારણો | ૪.૦ ગંભીર માનસિક રોગ                                  |
| ૨.૧ રોજિંદા જીવનમાં માનસિક તણાવ                 | ૫.૦ પોતાને અને બીજાને મદદ કરવી                        |
| ૨.૨ નુકશાન અથવા સ્વજનનું મૃત્યુ                 | ૫.૧ શીખી શક્યતા તેવા વ્યક્તિગત કોશાત્મો               |
| ૨.૩ સ્ત્રીના જીવનમાં આર્થિક કે અન્ય પરિવર્તનો   | ૫.૨ મદદરૂપ સંબંધો                                     |
| ૨.૪ માનસિક આધાત                                 | ૫.૩ સહાય જૂથ શરૂ કરવું                                |
| ૨.૫ શારીરિક સમસ્યાઓ                             | ૫.૪ સહાયજૂથ મદદ કેવી રીતે કરશો તે શીખવું              |
| ૩.૦ માનસિક સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યાઓ          | ૫.૫ માનસિક સમસ્યાનું જૂથ છારા નિરાકરણ                 |
| ૩.૧ હતાશા (તીવ્ર ઉદાસીનતા)                      | ૫.૬ આધાત પિડીત સ્ત્રીઓને મદદ                          |
| ૩.૨ ચિંતા રોગ                                   | ૫.૭ વ્યક્તિને આત્મહત્યા કરતાં રોકવી.                  |
| ૩.૩ આધાતની પ્રતિક્રિયાઓ                         | ૫.૮ વિસ્થાપિત અને નિરાશ્રીત બેનો અને માનસિક સ્વાસ્થ્ય |
|   | ૭.૦ તમારા સમાજનું માનસિક સ્વાસ્થ્ય સુધારવાના રસ્તા    |

## માનસિક સ્વાસ્થ્ય

જેમ સ્ત્રીનું શરીર તંદુરસ્ત કે બિમાર હોય છે તેમ તેનું મન અને જુસ્સો પણ તંદુરસ્ત કે બિમાર હોઈ શકે. જ્યારે મન અને જુસ્સો તંદુરસ્ત હોય ત્યારે તેનામાં પોતાની અને પોતાના કુટુંબની ભૌતિક જરૂરિયાતોની કાળજી લેવાની, પ્રશ્નો સમજવાની અને તેનો ઉકિલ લાવવાના પ્રયત્નો કરવાની, ભાવિ આયોજનો કરવાની અને બીજા સાથે સંબંધો બાંધવાની ભાવાત્મક શક્તિ હોય છે. આ બધી પરિસ્થિતિઓને એક સાથે પહોંચી વળવાનું અધિક છે. કેટલીક વાર સ્ત્રીઓને જીવનમાં મુશ્કેલીઓ સતત ચાલુ રહે છે. એનાથી તે થાકી જય છે અને સતત વ્યગ્ર રહેવાથી તેનું મન નબળું પડે છે. આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ કહેવાય. આ સમસ્યાઓ પારખવી અધરી છે. કેમ કે તે હેખાતી નથી. ઇતાં આ સમસ્યાઓ ધ્યાન માંગી લે છે અને તેનો ઉપયાર થવો જોઈએ.

આ પ્રકરણમાં માનસિક સ્વાસ્થ્યની સર્વસામાન્ય સમસ્યાઓ અને તેના કારણોનું વર્ણન કર્યું છે. સ્ત્રીઓ આવી સમસ્યાઓનો કેવી રીતે ઉકિલ લાવી શકે તેના સૂચનો પણ છે.

### ૧.૦ આત્મ ગૌરવ

જ્યારે સ્ત્રીને લાગે કે તે પોતાના કુટુંબને અને સમાજને માટે મહત્વની જવાબદારી નિભાવી રહી છે ત્યારે તે આત્મ ગૌરવ અનુભવે છે. આત્મગૌરવવાળી સ્ત્રી એમ માને છે કે તે સન્માનપૂર્વકના વ્યવહારની અધિકારી છે.

બાળપણથી જ આત્મગૌરવનો વિકાસ શરૂ થાય છે. માતા-પિતા, ભાઈ-ભહેન, પડોશીઓ, શિક્ષકો અને ધર્મગુરુઓ તેની સાથે કેવો વ્યવહાર કરે છે તેના પર સ્ત્રીના આત્મગૌરવના વિકાસનો આધાર છે. જે આ બધા તેને આદર આપે, એ કંઈક સારું કરે તો તેનાં વખાણ કરે અને અધરાં કામ કરવા તેને પ્રોત્સાહન આપે તો તેને એવું લાગશે કે તેનું મહત્વ સ્વીકારાય છે. તેના મનને આવા કામ કરવાની પ્રેરણા અને બળ મળે છે. તેનો આત્મવિશ્વાસ વધે છે. સમય જતાં કામ કરવાની આવડત પણ વિકસે છે અને આ બધાથી તેના આત્મગૌરવનું પોત ઘડાય છે.

આપણા સમાજમાં બાળપણથી જ ખોરાક, કામકાજ, શિક્ષણ, વિગેરે બાબતોમાં સ્ત્રીઓ માટે ભેદભાવ રાખવામાં આવે છે. તેનાં કામમાં વારે વારે વાંક શોધવામાં આવે, અધરા કામો કરે તો પણ તેની નોંધ ના લેવામાં આવે તો તેથી પોતે તુચ્છ છે એવો ભાવ તેના મનમાં જાગે છે. આવી આત્મ ગૌરવ વગરની છોકરી મોટી થઈને સ્ત્રી બને છે ત્યારે તે



પોતાના પતિ કે સમાજ તરફથી સારા વ્યવહારની અપેક્ષા કરી શકાય છે એવું માની શકતી નથી. તેનો પતિ તેનું માન રાખે, તેને પણ કુટુંબના અન્ય સભ્યો જેવો સારો ઓરાક મળે, સારી સારવાર મળે અને વ્યક્તિગત વિકાસની તક મળવી જેઠાચે એવું તે માનતી નથી. આમ, કુટુંબમાં અને સમાજમાં એનું મહત્વ જળવાતું નથી. તેના જીવનકાળમાં આવું અનેકવાર થવાથી તે પોતે પણ આ બધું સ્વીકારી લે છે. કુટુંબમાં અને સમાજમાં પોતાનું કોઈ મહત્વ નથી એ વાત સ્ત્રીઓને સહજ-સ્વાભાવિક અને સાચી લાગવા લાગે છે. ઘણી સ્ત્રીઓને આવું થતું હોય છે તેથી સામાન્ય સમાજ પણ એમ જ માને છે કે સ્ત્રીઓને સમાન અધિકારોની જરૂર નથી. ખરેખર તો આ પરિસ્થિતિ તદ્દન ગેરવાજબી અને અન્યાયી છે. છતાં આત્મગૌરવના અભાવે સ્ત્રી તે સ્વીકારી લે છે. સારા માનસિક સ્વાસ્થ્ય માટે આત્મ ગૌરવની લાગણી ખૂબ જરૂરી છે. આત્મગૌરવવાળી સ્ત્રી પોતાના પ્રશ્નો વધુ સારી રીતે ઉક્લી શકે છે. તેમ જ પોતાનું અને સમાજનું જીવન સુધારી શકે છે.



મીનું બાળક હતી ત્યારથી જ તેને પોતાના ભાઈઓ કરતાં ઓછું ધ્યાન મળતું હતું તેવો તેને ઘ્યાલ આવી ગયો હતો. તેના કુટુંબમાં બધા એમ માનતા હતા કે છોકરાઓ કરતા છોકરાઓ વધુ મહત્વના છે. માટે છોકરાઓને ભાષણા મૂક્યા હતા ત્યારે મીનુને ઘરકામણું જ રાખી હતી. તે કદી શાળાએ જઈ ના શકી.

### આત્મગૌરવ વિકસાવવું :

સ્ત્રી પોતે પોતાનું મૂલ્ય સમજી શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરવા આપણા સમાજમાં મોટા ફેરફાર લાવવા પડે, નહીં તો બાળપણથી જ તેના મન પર જ્ઞાત કે અજ્ઞાત અવસ્થામાં પડેલી મજબૂત માન્યતાઓને કારણે તે પોતાનું સાચું મૂલ્ય સમજતી નથી. તેનામાં આત્મગૌરવ વિકસતું નથી અને તે બધી અપમાનજનક પરિસ્થિતિઓ સ્વીકારી લે છે. તેથી તેનું જીવન દુઃખી બને છે અને તે પોતાના કુટુંબને કે સમાજને વિરોધત: ઉપયોગી થઈ શકતી નથી. આ પરિસ્થિતિમાં ફેરફાર લાવવા માટે આપણે આખા સમાજના સ્તરે કામ કરવું પડે. જે સમાજમાં સ્ત્રીઓની શક્તિઓ અને તેમની કાર્યક્ષમતાનો સ્વીકાર થાય, તેને

જે સ્ત્રીનું આત્મગૌરવ શક્તિશાળી છે તેનું શારીરિક સ્વાસ્થ્ય પણ સાચું રહે છે.

## માનસિક સ્વાસ્થ્ય

માન અને પ્રોત્સાહન મળે, તેને દ્વેક કામમાં ટેકો મળે અને નવી આવડતો અંગે તાલીમ મળે તો સ્ત્રીઓ પણ ગૌરવવંતી બને અને તેથી આખા સમાજનું સ્વાસ્થ્ય સુધરે.

માલિનીને નાનપણથી જ કહ્યાગરી અને સામુ બોલે નહીં એ રીતે ઉછેરવામાં આવી હતી. મોટી થઈ ત્યારે તેને પોતે પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવા હતાં પણ તેની માતાએ તેની અવગણના કરીને ૧૭ વર્ષની ઉંમરે બીજા સાથે પરણાવી. તેને ઉપરાઉપરી ચાર બાળકો થયાં. લગ્નના પ્રથમ દસેક વર્ષમાં જ તેનો પતિ વારંવાર બહાર રહેવા લાગ્યો હતો. પાડોશીઓ અને મિત્રોએ માલિનીને કહ્યું કે તેના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હતો. વિરોધ કરવાને બદલે માલિનીની માએ તેને આ સ્વીકારી લેવા સલાહ આપી. એક વખત તેનો પતિ તેની ઊ-મિત્ર સાથે રહેવા જતો રહ્યો. માલિની નિરાશ થઈ ગઈ અને પોતાને તદ્દન તુચ્છ સમજવા લાગી. પોતાનું અને બાળકોનું ભરણપોષણ કરવા તેને સખત મજૂરી પણ કરવી પડતી. બિમારી અને ગરીબીથી તે પરેશાન હતી.

ગામની શાળામાં બાળકોની સંભાળ લેવાના કામ માટે તે તાલીમ કાર્યક્રમમાં જોડાઈ. આવું કામ પહેલાં ક્યારેય કર્યું ન હોવા છતાં તાલીમ દરમ્યાન નવાં કૌશલ્યો શીખીને અને બીજાઓ સાથે રહીને તેણે આ કામ સરસ રીતે કર્યું. આ અનુભવમાંથી એને લાગ્યું કે તેનામાં ખરેખર સૂક્ષ્મ અને શક્તિ છે. તેને શાળામાં નોકરી ન મળવા છતાં તે નિરાશ ન થઈ. તેણે થોડો થોડો સમય કાઢી બીજી સ્ત્રીઓને આ બધું શીખવવા માંડ્યું. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધ્યો અને સૌ તેનો આદર કરવા લાગ્યા. આથી તેને સમજયું કે પોતે પણ પોતાના જીવનમાં જે ઝંખે છે તે કરી શકે એમ છે.

પ્રૌઢ વચ્ચે માલિની  
નવાં કૌશલ્યો શીખી  
અને પોતાનું મૂલ્ય  
સમજ શકી.



### ૨.૦ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનાં સામાન્ય કારણો


જીવનની સમસ્યાઓનો સામનો કરતી દ્વેક સ્ત્રીને માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો ઉભા થતા નથી. પણ દબાણ સહન કરવાની તેની શક્તિ કરતાં ય વધુ મુશ્કેલી પડે ત્યારે સ્ત્રીઓને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉભી થાય છે. બધી સમસ્યાનાં કારણો શોધી શકાતાં નથી. કેટલીકવાર તો આમ શા માટે બન્યું તેની સમજણ જ પડતી નથી. તેથી તેનો ઉક્ત પણ નીકળતો નથી. આવા સમયે તેને પ્રેમ અને હુંફની ખાસ જરૂર પડે છે.

## ૨.૧ રોળુંદા જીવનમાં માનસિક તણાવ :

રોળુંદી પ્રવૃત્તિઓ અને પ્રસંગો સ્ત્રી પર જે દખાણ લાવે છે, એનાથી એના શરીર અને મન પર તણાવ પેદા થાય છે. એ માંદગી કે વધારે કામના બોજ જેવા કારણોસર હોય કે કુટુંબમાં પેદા થતાં ધર્ષણ અથવા વગર વાંકે તેના પર થતા દોષારોપણ જેવાં કારણોને લીધે પણ હોઈ શકે. કેટલીક વાર બાળકનો જન્મ કે નોકરી મળે એવા આનંદના પ્રસંગો પણ તેના પર તાણ લાવી શકે, કેમ કે આવા પ્રસંગો સ્ત્રીના જીવનમાં પરિવર્તન લાવનારા છે, અપેક્ષાઓ વધારનારા છે અને જે ધરમાં તેના કામની વહેંચણી કરનાર કોઈ ના હોય તો તેના પર કામનો બોને અગાઉ કરતાં ઘણો વધી જય છે. આવા સંજ્ઞેગોમાં બીજી સમસ્યા ના હોવા છીતાં તેને માનસિક સમસ્યા થઈ શકે છે.

માનસિક સ્વાસ્થ્ય સાંચે રાખવા સ્ત્રીઓને પોતાના જીવન પર વધારે કાયુ અને શક્તિની જરૂર છે.

રોળુંદા જીવનની મુશ્કેલીઓથી માનસિક તાણ થાય છે એ વાત માન્યામાં નથી આવતી. કેમકે એ તો કાયમનું છે. પણ આ તાણનો સામનો કરવામાં કે તેને સહન કરવામાં સ્ત્રીની શક્તિ ઘણી ખર્ચાય છે. એ વાત સૌઅને સ્વીકારવી જેઈએ.



આપણા સમાજમાં સ્ત્રીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે તેણે પોતાની લાગણી જેવી કે, ગુર્સ્ટો, દુઃખ, તણાવ, ખુશી કે ઉમંગ દ્વારાવીને બીજા લોકોને માટે રોજિંદા કામો કર્યા કરવા જેઈએ. તેથી ઘણી સ્ત્રીઓ વિરોધાભાસ અનુભવે છે. તેમાંથી તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ત્રી દરરોજ અને લાંબા સમય સુધી ખૂબ તણાવનો સામનો કરે છે. ત્યારે પોતે ‘બોન્લ નીચે દ્વારા ગઈ હોય’ અને પહોંચી વળાશો નહીં એમ માને છે. જે નાનપણથી જ તેને એવું શીખવવામાં આવ્યું હોય કે તેણે પોતાના ભોગે બીજાની ચિંતા કરવી જેઈએ તો એ પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકશો જ નહિ. તેનો તનાવ ઓછો કરવા માટે આનંદ પ્રમોદની જરૂર હોવા છતાં તેની પાસે સમય કે શક્તિ હોતાં નથી. પરિસ્થિતિને સમૂળી બદલવા તેની પાસે પૂરતી તાકાત પણ હોતી નથી તેથી તેની સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ પકડે છે.



ઘણીવાર સ્ત્રીને બધા એવું માનવા પ્રેરે છે કે તે બિમાર છે અને ખૂબ નબળી થઈ ગઈ છે. પણ ખરેખર તો આવી બેનોના જીવનમાં કોઈ અપ્રિય અને અન્યાયી વાત છે, જેને લીધે તે પરેશાન છે.

## ૨.૨ નુકશાન અથવા સ્વજનનું મૃત્યુ :

જ્યારે સ્ત્રી તેનું સ્વજન, મિત્ર, ધર કે નોકરી ગુમાવે અથવા વધારે પડતી બિમાર થાય અથવા અપંગ બની જય ત્યારે તે દુઃખમાં દૂબી જય છે. દુઃખ વ્યક્ત કરી લેવું તે નુકશાન કે મૃત્યુથી ઉભી થતી પરિસ્થિતિનો સ્વાભાવિક પ્રતિભાવ છે. જે સ્ત્રીને રોજિંદા જીવનનો ઘણો બોજ લાગતો હોય છે કે તેને લીધે અત્યંત તાણભરી પરિસ્થિતિમાં જીવતી હોય છે તે સ્ત્રીને પ્રિયજનનું મૃત્યુ કે આકસ્મિક નુકશાનને લીધે માનસિક સમસ્યા થઈ શકે છે. વળી કોઈવાર આવા પ્રસંગો બને ત્યારે તે કોઈ બીજા સ્થળે હોય અથવા પરંપરાગત રીતે રડવાનું કે દુઃખ વ્યક્ત કરવાનું શક્ય ના બને ત્યારે પણ તેને માનસિક સમસ્યા થઈ શકે છે.



## ૨.૩ સ્ત્રીના જીવનમાં આર્થિક કે અન્ય પરિવર્તનો :

આર્થિક પરિવર્તનો કે રાજકીય સંઘર્ષોના કારણે સમાજમાં ઝડપી પરિવર્તનો આવે છે જેથી કુદુંબોએ અને સમાજે પોતાની સમગ્ર જીવન પદ્ધતિ બદલવી પડે છે.



યુદ્ધ શરૂ થયું ત્યારે લશકરના જવાનો અમારા ગામમાં આવ્યા. પુરુષોને લડવાની ફરજ પાડી. સ્ત્રીઓ પર બળાત્કાર ગુજલાયા. અમે પર્વતોમાં સંતાઈ ગયાં. પણ ત્યાં આવાનું ના મળે. અત્યારે અમે નિરાશ્રિત તરીકે કેમ્પમાં રહીએ છીએ. આવાનું મળે છે પણ ઘણા લોકો બિમાર છે. કેમ્પમાં બધા માણસો અજાણ્યા છે. મને એમ થાય છે કે ઘેર પાછા જવાશે કે નહીં. ?



અમારે ત્યાં પાક ઓછો ઉત્તરે છે. દેવું કરીને ખાતર-પાણી નાખ્યાં પણ કમાણી થઈ નહીં. બેંકનું દેવું થયું. ગામ છોડવું પડ્યું. અત્યારે નજીકના શહેરની ભાગોળે ઝૂપડાંમાં રહીએ છીએ. સવારે પક્ષીઓનો અવાજ પણ સાંભળવા મળતો નથી કેમ કે અહીં પક્ષીઓ જ નથી. લોકોનાં ઘરનાં કચરા-પોતાં કરીને કે મજૂરી કરીને અમે જીવન ગુજરીએ છીએ.

જ્યારે કુદુંબો ધ્રૂટાં પડી જય અથવા જીવન એવું બદલાઈ જય કે પહેલાંનું કંઈ હેખાય જ નહીં કે અનુભવાય જ નહીં ત્યારે માનસિક સ્વાસ્થ્યની સમર્થ્યાઓ સર્જય છે.

## ૨.૪ માનસિક આધાત :

જ્યારે સ્ત્રી સાથે કે તેના સ્વજન સાથે કોઈ ભયાનક ઘટના બને ત્યારે તે આધાત અનુભવે છે. આધાતની ડેટલીક સામાન્ય ઘટનાઓમાં ઘરમાં કોઈને ભયાનક રોગ થાય, કોઈનું મરણ થઈ જય, ઘણું મોટું આર્થિક નુકસાન જય, ઘરના કોઈ સભ્ય મારા-મારી, બળાત્કાર, યુદ્ધ, રિબામણી અને કુદરતી આફ્કટનો ભોગ બને, વગેરેનો સમાવેશ થાય છે.



આધાત માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીને હચમચાવી મૂકે છે. પરિણામે વ્યક્તિ લાચારી, નિઃસહાયતા કે અસલામતી અનુભવે છે. એ વ્યક્તિ કોઈના પર ભરોસો મૂકી શકતી નથી. જે આધાત કોઈ માણસ તરફથી થયો હોય તો સ્ત્રીને આધાતમાંથી બહાર આવતાં વાર લાગે છે. બાત્યાવસ્થામાં અનુભવેલો આધાત તે વખતે શું થયેલું એની પૂરી જાણકારી ન હોય તો પણ મોટી ઉંમરે તે સ્ત્રી પર અસર કરે છે.

## માનસિક સ્વાસ્થ્ય

ધરતીકંપમાં ૧૨ વર્ષની રત્નાની મા, બે ભાઈઓ અને નાની બેન મરી ગયાં. તેના પિતા અને તે જ બચી શક્યાં. આજે રત્ના બોલતી નથી કે ઉંઘતી નથી. એક પૂતળાની જેમ પિતાની સાથે તૂટેલા ધરનું રીપેર કામ અને અન્ય કામો કર્યા કરે છે. રત્નાને લાગેલ આધાત ખૂબ ઊંડો છે. તે ક્યારે તેમાંથી બહાર આવશે તે કહી શકાય નહીં.

### ૨.૫ શારીરિક સમસ્યાઓ :

કેટલીક માનસિક સમસ્યાઓ શારીરિક સમસ્યાઓમાંથી જન્મે છે. દા.ત.

- \* શરીરમાં અંતઃખાવના કે અન્ય ફેરફારો થાય. \* એચ.આઈ.વી. જેવા ચેપ
- \* દાડું અને નશીલા પદાર્થોનો વધારે પડતો ઉપયોગ. \* અપૂરતું પોષણ
- \* જંતુનાશક, વનસ્પતિનો નાશ કરવા માટેની દવાઓ અને ઔદ્યોગિક દ્રાવણ
- \* લીબર અને કીડનીના રોગો \* મૂછા, ચિત્તભ્રમ અને માથાની ઇજ
- \* ખૂબ દવાઓ લેવી પડતી હોય કે અને દવાઓની આડ અસરો થાય છે.

માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો ઠલાજ કરતા હો ત્યારે પહેલાં શારીરિક કારણાની શક્યતા તપાસો. એ પણ યાદ રાખો કે શારીરિક સમસ્યાઓ માનસિક સમસ્યાઓનાં ચિનહે પણ હોઈ શકે.

### ૩.૦ માનસિક સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યાઓ



માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે. પણ ચિંતા, હતાશા કે દાડું અને નશીલા પદાર્થોનો દૂરઉપયોગ ખૂબ સામાન્ય ગ્રસ્તો છે. પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગોથી વધારે પીડાય છે. કોઈને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે કે નહીં તે નક્કી કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખો.

- \* જીવનની ઘટનાઓનો સામાન્ય પ્રતિભાવ અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વચ્ચે સ્પષ્ટ બેદરેખા નથી.
- \* લગભગ બધા લોકોને જુદા જુદા સમયે આવાં ચિનહે દેખાય છે કેમ કે દરેકને ક્યારેકને ક્યારેક, કોઈને કોઈ મુશ્કેલી તો હોય જ છે.
- \* જુદા જુદા સમાજેમાં આ સમસ્યાઓના લક્ષણો જુદા જુદા હોઈ શકે છે. કેટલાક સમાજમાં જે વર્તન અસામાન્ય ગણાય તે બીજા સમાજમાં સામાજિક ઝઢીઓ કે મૂલ્યો પ્રમાણે સામાન્ય ગણાતું હોય તેવું પણ બની શકે છે.

### ૩.૧ હતાશા (તીવ્ર ઉદાસીનતા અથવા પોતાને તુચ્છ ગણવું.)

જ્યારે કોઈ સ્ત્રી કશુંક ગુમાવે અથવા કોઈનું મરણ થાય તો તે હતાશા અનુભવે એ સ્વાભાવિક છે. પણ જે નીચેનાં ચિનહો લાંબો સમય રહે તો માનસિક સ્વાસ્થ્યની સમસ્યા કહેવાય.

હતાશા કે ઉદાસીનતાને કેટલાક લોકો હદ્દ્યમાં ખૂબ ભારે લાગવું કે આત્મશક્તિ ખૂટી ગઈ એવું પણ કહે છે.



#### ચિનહો :

- \* કાયમ નિરાશ કે ઉદાસીન રહેવું. \* ઉંઘ ન આવે અથવા ખૂબ ઉંઘ આવે.
- \* સ્પષ્ટ વિચારી ન શકાય. \* જમવાનું મન ન થાય,
- \* આનંદની પ્રવૃત્તિ કે જાતીય પ્રવૃત્તિમાંથી રસ ઉડી જય.
- \* બોલવાનું અને હુલન-ચલન ધીમાં થઈ જય.
- \* રોળુંદી પ્રવૃત્તિ માટે શક્તિ ના હોય તેવું લાગે.
- \* મરણ કે આત્મહત્યાના વિચારો આવે.
- \* માથાનો દુઃખાવો, કબજીયાત, અપચો જેવી શારીરિક તકલીફો જે કોઈ બિમારીને કારણો નથી.

તીવ્ર હતાશા સીને આત્મહત્યા તરફ દોરી જય છે. દરેકને કોઈક વાર તો આવો વિચાર આવે પણ જે આવા વિચારો રોજ-રોજ આવે અને તેણે આત્મહત્યાનો નિર્ણય કર્યો છે તેવી ખબર પડે તો એવી સીને તરત જ મનોચિકિત્સકની મદદ આપવી જેઠાંથે.

### ૩.૨ ચિંતા રોગ :

જુદા જુદા સમયે દરેક વ્યક્તિ ગુસ્સો, ચિંતા કે શિથિલતા અનુભવે, પણ જ્યારે એ ચિંતા કરાવનાર પરિસ્થિતિ દૂર થાય એટલે વ્યક્તિ સામાન્ય બની જય. આ ચિંતા ચાલુ જ રહે કે તીવ્ર બનતી જય કે કોઈ પણ કારણ વગર પણ તે વ્યક્તિ ચિંતા અનુભવે ત્યારે તે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા બને છે.



## માનસિક સ્વાસ્થ્ય

---

### ચિનહ્ણો :



- \* કારણ વગર તાણા કે શિથિલતા અનુભવાય,
- \* પરસેવો થાય, હૃદયરોગ ન હોય તો પણ ઘબકારા થાય.
- \* સ્પષ્ટ વિચારી ન શકાય.
- \* શારીરિક કારણો ન હોય છતાં શારીરિક ફરીયાદો વારંવાર થાય અને સ્વી જ્યારે અસ્વસ્થ હોય ત્યારે એ ફરીયાદો વધે.

- \* વધુ પડતો ગભરાટ કે ધ્રાસ્કો માનસિક ચિંતાનો તીવ્રતમ પ્રકાર છે. આ અચાનક થાય છે અને થોડી ક્ષણોથી થોડા કલાકો સુધી ચાલે છે. આ વ્યક્તિને ડર લાગે છે કે તે બેભાન થઈ જશે અથવા મરી જશે. તેને છાતીમાં દુઃખાવો થાય. શ્વાસ ના લેવાય અને કંઈક ભયાનક બનવાની બીક લાગે.

### ૩.૩ આધ્યાત્મની પ્રતિક્રિયાઓ :

આધ્યાત્મના અનુભવ પછી વ્યક્તિની પ્રતિક્રિયાઓ જુદી જુદી હોય.

- \* તેની સાથે જે ભયંકર ઘટનાઓ બની હોય તે જ ચાદ આવ્યા કરે. રાતે તેને આ જ સ્વખાં આવે કે આ વિચારોથી ઉંઘ જ ના આવે. સૂતા-જગતાં સતત આધ્યાત્મના વિચારોમાં જ જીવે. કેટલીકવાર આ બેનોને તે જ ઘટના કે તેથીય વધુ ભયંકર ઘટના તેની સાથે બને છે તેવો અનુભવ થયા કરે છે. હક્કિતમાં આવું કશું જ અત્યારે બનતું હોતું નથી. આમ આવી ઘટનાના ભણકારા અને તેનાથી થતું દુઃખ કે પીડા આ બેન વારંવાર અનુભવ્યા કરે છે.
- \* મૂઢ થઈ જવાય કે પહેલાં જેવી લાગણીઓ અનુભવાય નહીં. આધ્યાત્મની ચાદ કરાવે એવા લોકો કે સ્થળોથી દૂર રહે.
- \* ખૂબ સાવધ બની જય. તેને હંમેશાં ભય જ હેખાતો હોવાથી ઉંઘ ના આવે. કયારેક ચોંકી ઉઠી ત્યારે વિચિત્ર વર્તન કરે.





- \* જે બની ગયું છે તેના તરફ ગુસ્સો આવે કે તે બાબતે શરમ આવે. જે આવી કોઈ ઘટનામાં જે તે વ્યક્તિ બચી ગઈ હોય પણ બીજાં લોકો મરી ગયાં હોય અથવા ગંભીર ઈજ પામ્યા હોય તો તે પોતે બચી ગઈ તે માટે જલ્દે જ્ઞાનિ કે ગુનાની લાગણી અનુભવે.
- \* માનસિક ગૂંઘવાડાને લીધે તેનું વર્તન વિચિત્ર બને ક્યારેક હિંસક પણ બની જય. કારણ તેને સમય-સ્થળનું ભાન નથી રહેતું.
- \* બીજનથી પોતાને અલગ માને અને અંતર-અનુભવે.

આમાનાં ધણાં લક્ષણો મુશ્કેલ પરિસ્થિતિનાં સામાન્ય પ્રતિભાવો હોય છે. આધાત પછી ગુસ્સો આવે એ સ્વાભાવિક છે અને પરિસ્થિતિ હજુ પણ બ્યાન્ઝનક અથવા જ્ઞેખમી હોય તો એ સાવધાની રાખે એ પણ સ્વાભાવિક છે. પણ જે આ ચિંતા તેને રોજુંદું કામ કરતાં અટકાવે કે મહિનાઓ પછી પણ આવાં ચિનહે દેખાય તો એ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા કહેવાય.

આધાત પામેલ લોકોને ચિંતા થાય અને હતાશા થાય. આવા લોકો ક્યારેક નશાકારક વ્યસનો પણ કરવા માંડે છે.

### ૩.૪ માનસિક તાણથી થતા શારીરિક ફેરફારો અને રોગો :

જ્યારે માણસને માનસિક તાણ પેદા થાય ત્યારે તેનો સામનો કરવા જરૂરી પ્રતિક્રિયા માટે શરીર તૈયાર થઈ જય છે. આ સંલેગોમાં જે પરિવર્તનો આવે તે આવાં હોય :

- \* હૃદય જરૂરી ધબકવા લાગે      \* લોહીનું દબાણ (બી.પી.)  
ઉચ્ચું જય      \* શાસ જરૂરી ચાલે      \* પાચનશક્તિ મંદ થાય.




તાણનું કારણ અચાનક અને ગંભીર હોય તો સ્વી આવા ફેરફાર અનુભવે અને જ્યારે તે દૂર થાય ત્યારે તે ચિનહે પણ જતાં રહે. ક્યારેક તાણનું કારણ ઓછું ગંભીર હોય અથવા તાણ ધીમે ધીમે વધે ત્યારે આ શારીરિક ફેરફાર એટલા ધીમા થાય છે કે સ્વીના ધ્યાનમાં આવતાં નથી. આ બધાં ચિનહે હાજર હોય કે ના પણ હોય. તાણનું કારણ લાંબો સમય રહે તો ચિંતા અને હતાશાનાં જેવાં ચિનહે આવે, દા.ત. માથું દુઃખ્યા કરે, પેટમાં દુઃખે, નબળાઈ લાગ્યા કરે, વગેરે. કેટલીકવાર સતત તાણને કારણે બીજા માંદગી અને લોહીનું ઉચ્ચું દબાણ પણ રહે. જ્યારે લાગણીજન્ય સમસ્યાઓને મહત્વ અપાતું નથી ત્યારે તાણ હતાશા, ચિંતાના શારીરિક ચિનહે વધારે દેખાય. તેથી શારીરિક ચિનહેની અવગાણના ના કરવી અને બિમારીનાં લાગણીજન્ય કારણો તરફ સંજગ રહેવું એ ઉત્તમ છે.

## માનસિક સ્વાસ્થ્ય

### ૪.૦ ગંભીર માનસિક રોગ

જે કોઈ વ્યક્તિને નીચેનામાંથી કોઈ ચિનહો હોય તો એ ગંભીર માનસિક બિમારી કહેવાયાં :



- \* બીજ કોઈને દેખાતી કે સંભાળતી ન હોય એવી અસામાન્ય વસ્તુઓ જુઓ કે અવાજે સાંભળે (ભાંતિ)
- \* તેની વિચિત્ર માન્યતાઓ એના જીવનમાં દ્યાલ કરે. (ચિત્તભ્રમ) દા.ત. તે એમ માનતી હોય કે તેના પ્રિયજનો તેને મારી નાંખશે
- \* તે પોતાની કાળજી ન લેતી હોય. દા.ત. કપડાં ના પહેરે. નહાય નહીં, ખાય નહીં વિગેરે.
- \* તેનું વર્તન વિચિત્ર હોય, દા.ત. નિર્થક બકવાસ કરે.

માનસિક રીતે બિમાર વ્યક્તિને સારવાર ઉપયોગી છે પણ તેની સાથેના વ્યવહારમાં ભલાઈ, આદર અને ગૌરવ જળવવું વધુ અગત્યતા છે.

ઘણીવાર જે લોકો માનસિક રીતે બિમાર ન હોય તેઓ પણ આવું વર્તન કરતા હોય છે. દા.ત. કેટલાક લોકો એમ કહે કે તેમને સ્વભનમાં દેવીમા અમુક વાત કહી ગયા છે, તો તે તેમના સમાજમાં પારંપરિક રીતે આવી કોઈ માન્યતાઓ હોવાને કારણે કહેતા હોય છે. તેઓને માનસિક બિમારી નથી હોતી. પરંતુ જે આવું વારંવાર થયા કરે અને તે વ્યક્તિ પોતાનું રોજિંદુ જીવન પણ બરાબર જીવી ના શકે એમ થાય ત્યારે તે વ્યક્તિને માનસિક બિમારી છે એમ કહી શકાય.

આપણા સમાજમાં ચિત્તભ્રમ લોકોને નકામા ગણવામાં આવે છે. તેઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ રાખતું નથી. તેમની ડેકડી ઉડાડવામાં આવે છે, તેઓને શારીરિક રીતે પણ હેરાન કરવામાં આવે છે. વહેમ અને અંધશ્રદ્ધાને વશ કેટલાક સમાજેમાં બડવા-ભૂવાનો આશરો લઈ આ વ્યક્તિને સામાજિક, શારીરિક તથા આર્થિક નુકસાન થાય એવું કરવામાં આવે છે. શહેરી સમાજમાં આવા લોકોને ગાંડા ગણી ગાંડાના દવાખાનામાં દાખલ કરી દેવામાં આવે છે.

આ પરિસ્થિતિને સુધારવા માટે ઘણી ધીરજ અને સમયની જરૂર છે. પણ આ વિષયમાં સમાજ પરિવર્તનનું પ્રથમ પગલું તે માનસિક રીતે અસ્વસ્થલોકો પરત્વે સહાનુભૂતિ અને પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવા અંગે સૌને જગૃત કરવા તે જ છે. જે તમારા ધરમાં કે આસપાસ આવો કોઈ કિસ્સો હોય તો તેની સારવાર અંગે નક્કી કરો કે,



- \* તેને અપાતી વિવિધ સારવારની શું અસર થઈ શકે ? દરેક વસ્તુ કે દવાનું શું પરિણામ આવી શકે તે પણ જાણી રાખો.
- \* તે જે પોતાને માટે કે પોતાના કુટુંબીજનો માટે ભયજનક ન હોય તો તેને ઘરે રાખીને સારવાર આપી શકાય કે કેમ ?
- \* તેની સારવારમાં તેના કુટુંબીજનોનો શું ફાળો હશે ? કુટુંબીજનો તરફથી કેવી રીતની મદદ અપેક્ષિત છે.
- \* તેને અપાતી સારવારથી તેને કોઈ શારીરિક નુકશાન તો નહીં થાય ને કે તેથી દર્દીને માટે શરમજનક પરિસ્થિતિ તો નિર્માણ નહીં થાય ને !
- \* જે વ્યક્તિ સારવાર આપે છે તેનું સમાજમાં માન છે ? તે સારવારના વિષયમાં કાર્યકુશળ છે ? ઉપરોક્ત પ્રશ્નોના જવાબ તમને સંતોષજનક મળે તો જ જે તે દર્દીને સારવાર અપાવો. આધુનિક તબીબી વિજ્ઞાનમાં પણ આવા દર્દીની સારવાર માટે પૂરેપૂરી જણકારી નથી. તેથી જે તે દર્દીની સારવાર અંગે અંધારામાં ન રહેતાં વ્યવહારીક રીતે વિવેકપૂર્ણ અભિગમ અપનાવવો જરૂરી છે.

#### પ.૦ પોતાને અને બીજાને મદદ કરવી



માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓવાળી વ્યક્તિને ઉપચારથી રાહત લાગે છે. માનસિક સ્વાસ્થ્યની સેવાઓ દરેક ડૉક્ટર આપી શકતા નથી. આપણે ત્યાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સંખ્યા ખૂબ ઓછી છે અને તેઓ મોટેભાગે મોટા શહેરોમાં જ સેવાઓ આપે છે. તેથી આવા પ્રશ્નોનો ઉકેલ સ્ત્રીઓએ આપસૂજથી જ લાવવો પડે છે. તે પોતાના વ્યક્તિગત કૌશલ્યો વધે તેવા પ્રયત્નો કરી શકે. પણ આવા

વ્યક્તિને ટેકાડ્યુપ થવા માટે તેની આવડતો ધ્યાનમાં રાખીને બીજ વ્યક્તિઓ મદદ કરી શકે.

પ.૧ શીખી શકાય તેવા વ્યક્તિગત કૌશલ્યો : નીચેના સૂચનો ઉપયોગી થાય.

વ્યક્તિગત રાહત મેળવવી : સામાન્ય રીતે સ્ત્રીઓ ઘરકામમાંથી બહાર આવતી નથી. પણ આવા સમયે રોજંદા પ્રશ્નો બાજુ પર મૂકીને મનગમતી




ગંભીર બિમારીવાળા દર્દીના ધરના લોકો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવાથી દર્દીની પરિસ્થિતિ વિશે વધુ જ્યાલ આવશે.



## માનસિક સ્વાસ્થ્ય

પ્રવૃત્તિ માટે સમય કાઢવો, નિરાંતે એકલાં બેસીને વિચારવું. બજરમાં જવું, બાગકામ કરવું કે મનગમતા માણસો સાથે સમય ગાળવો, ઉજાણી કરવી વિગરે.

સમસ્યાઓ તીવ્ર હોય તો દવાની જરૂર પડે છે. જે ડૉક્ટરને માનસિક રોગની દવા વિશે બરાબર જ્ઞાન હોય તેને મળો.



**અભિવ્યક્તિ :** તમારી લાગણીઓ વ્યક્ત થાય તેવી પ્રવૃત્તિઓ કરી શકાય. જેમ કે કવિતા કે ગીતો રચવા, વાતાઓ લખવી કે કહેવી વગેરે. ખાસ કરીને જ્યારે તમારી લાગણીઓ વિશે કોઈને કહી ના શકતા હોય ત્યારે આવા માધ્યમો ઉપયોગી નીવડે છે. તમે ચિત્ર દ્વારા પણ લાગણીઓ વ્યક્ત કરી શકો છો. યાદ રાખો કે ચિત્ર દોરવા માટે તમારે ચિત્રકાર જેટલી આવડતની જરૂર નથી.

**વાતાવરણ સુધારો :** તમને ગમે તેવી વસ્તુઓ તમારી આજુભાજુ મૂકો. જ્યારે નાની-ભોઈ વસ્તુઓ તમને ગમતી હોય તેવી રીતે ગોઠવશો તો તમારું મનપ્રસન્ન રહેશો અને તમને શાંતિનો અનુભવ થશો. તમારી આસપાસ પૂરતું અજવાણું અને ચોખ્ખી હવા રહે તેવો પ્રયત્ન કરો.



સુંદર વસ્તુઓ તમારી આસપાસ હશે તો પણ તમને આનંદ ભળશે. જેમકે, તમારા ડુઃખમાં તમે કૂલદાનીમાં કૂલ ગોઠવો કે તમને ગમે તેવું સંગીત સાંભળો વગેરે... સગવડ અને સમય હોય તો કોઈ માણવાતાયક રમણીય સ્થળની મુલાકાત લો.



દુઃખમાં, તમને જે પ્રવૃત્તિમાંથી આનંદ ભળતો હોય તેવી પ્રવૃત્તિ કરવાની કોશિશ કરો. ધણીવાર એને માટે મોટું આયોજન કરવું શક્ય ના બને. છતાં તમે તમારી રીતે ઝુશ રહેવાનો પ્રયત્ન કરશો તો પેલા દુઃખદાયક અને તાણ પ્રેરનારા પ્રસંગની અસર ઓછી થતી જશે અને તમે એક સુષ્વિવસ્થિત જીવનમાં ગોઠવાતા જશો.

મનને શાંતિ મળો તેવી પ્રવૃત્તિ કરો :

આંતરિક શક્તિ વધે એવી પ્રણાલિકાગત પ્રવૃત્તિઓમાં જોડાઓ. જેમકે યોગ, પ્રાર્થના, ધ્યાન, કસરત વગેરે



આ પ્રણાલીઓનો નિયમિત મહાવરો માનસિક તનાવ તેમજ બીજી ધણી માનસિક મુશ્કેલીઓમાં મદદરૂપ થાય છે.

**૫.૨ મહદૃપ થાય એવા સંબંધો વિકસાવો :**

આવા સંબંધોમાં વ્યક્તિ એકબીજને સમજે છે અને ઓળખે છે. આવી વ્યક્તિઓ ભિત્રો હોય, સાથે કામ કરતા હોય, પાડોશી હોય, કુટુંબી હોય અથવા એવા નવા જ માણસો જે તમારી લાગણીઓનો આદર કરે અને જેમની સાથે તમારા પ્રશ્નોની ચર્ચા થઈ શકે.

તમારી સમસ્યાને ખાનગી રાખીને એના ઉકેલ માટે સહાનુભૂતિપૂર્ણ પ્રયત્ન કરવામાં મહદ કરે. સરખી સમસ્યા હોય તેવા કેટલાક લોકો સાથે મળીને જૂથ બનાવીને એકબીજને સધિયારો આપી શકે છે. કેટલીક સામાજિક સંસ્થાઓ કે મંડળો આવા સહાયજૂથ દ્વારા કામ કરી રહ્યાં છે.

આ સ્વીઓ કામ કરતાં કરતાં એકબીજની સમસ્યાઓ દ્યાનપૂર્વક સાંભળે છે.



**એકબીજને સહાય કરવી :**

એકબીજને ઓળખતી હોય એવી બે વ્યક્તિઓ ભેગી થાય તો પણ મહદૃપ થાય એવા સંબંધો બંધાતા વાર લાગે છે કેમ કે લોકો પોતાની સમસ્યાઓ બીજને કહેતાં ખચકાય છે. એકબીજન પર વિશ્વાસ મૂકતાં સમય લાગે છે. અહીં વિશ્વાસપૂર્ણ સંબંધો કેવી રીતે બાંધી શકાય તે માટે સૂચનો મૂકેલા છે :

- \* બીજુ વ્યક્તિ જે કહે તે અંગે કોઈ નિર્ણય બાંધ્યા સિવાય ખુલ્લા મને સાંભળો.
- \* બીજુ વ્યક્તિ શું અનુભવે છે તે સમજે તમારા આવા અનુભવને યાદ કરો અને શક્ય હોય તો તેની સાથે તે અંગે વાત કરો. પણ બીજ વ્યક્તિની વાતને તમારા જ અનુભવના માળખામાં ગોઠવવાનો પ્રયત્ન ના કરશો. તમને એની વાત ના સમજય તો એને ફરી સમજવવા કહો.. પણ તેની વાત નકારશો નહિ.
- \* શું કરવું તેની સલાહ આપશો નહીં. એના પર તેના કામનું, ધરનું, કુટુંબીજનોનું કે સમાજનું દબાણ કેવી રીતે આવે છે અને તેની લાગણી પર અસર કરે છે તે સમજવો. આમ તેના માનસિક દબાણોનું સ્વરૂપ જ તેને સમજવો. નિર્ણય તેના પર છોડો.



- \* એવું ક્યારેય વિચારશો નહીં કે આ સ્ત્રીને મદદ કરી શકાય એમ છે જ નહીં.
- \* એની ગુપ્તતાનો આદર કરો. તેનું જીવન બચાવવા માટે બીજાને વાત કરવી જરૂરી હોય તો જ બીજાને કહો. તેના ભલા માટે એ વાત બીજાને કરવી હોય તો પણ એની મંજુરી લો.

#### પ.૩ સહાય જૂથ શરૂ કરવું.

૧. જે સ્ત્રીઓને આમાં રસ હોય એવી બે કે વધુ સ્ત્રીઓ શોધી કાઢો.



2. મળવાની જગ્યા નક્કી કરો. આ જગ્યા બને તેટલી એકાંત અને શાંત હોવી જેઠાં. તમારા ગામમાં આવેલ શાળા, આરોગ્ય કેન્દ્ર સંસ્થા કે મંદિરના મકાનનો ઉપયોગ કરી શકાય.
3. પહેલી બેઠકમાં તમે શું કરવા માંગો છો તેની વાત કરો. તમે જૂથબનાવ્યું હોય તો નેતા નક્કી કરો.

બીજાનું સહયોને જૂથમાં લેવા છે કે કેમ તે નક્કી કરો.

4. જે સ્ત્રીએ આ જૂથ બનાવ્યું હોય તેણે પહેલી બેઠકનું સંચાલન કરવું પડશે. જૂથ માટે તેણે એકલા નિર્ણયો ન લેવા જેઠાં. બધી બેનોને બોલવાની તક મળવી જેઠાં. ચર્ચા પાટા પરથી ઉત્તરી ન પડે અને નિર્ણયો આવે એટલું જ તેણે ધ્યાન રાખવાનું છે. વારાફરતી બધી બહેનો જૂથ બેઠકોનું સંચાલન કરે તેમ ગોઠવી શકાય. આમ કરવાથી શરમાળ બેનો પણ આગળ આવશે અને પોતાની વાત રજૂ કરતાં શીખશે તથા બીજાની વાત સંભાળતા અને સમજતાં શીખશે.



બીજા સાથે લેગાં મળવાથી સ્વીને  
લાભ થાય :

- \* સહારો મળો. માનસિક પ્રક્રોથી સ્વીની શક્તિ ક્ષીણ થાય છે અને નિરાશા આવે છે. ભેગા મળવાથી આ શક્તિ વધે આશાનો સંચાર થાય છે અને તેનાથી તેને રોળંદા કામ કરવાની તકાત મળે છે.



મિટિંગમાં આવીએ ત્યારે આપણે ખૂબ દુઃખી હોઈએ છીએ અને કશુંય બોલવાની ઈરછા ન થાય. પણ બીજ બેનો આગ્રહ કરે અને એમનો જુસ્સો જેવાથી આપણી શક્તિ પણ વધે છે.

- \* લાગણીઓને માન્યતા મળશે. કેટલીક વાર સ્વીઓ પોતાની લાગણીઓ ખરાબ, ભયંકર અને શરમજનક છે એમ માનીને છૂપાવે છે. જૂથમાં બીજને સાંભળવાથી એને સાચો ઘ્યાલ આવે છે કે આ લાગણીઓ પર ધ્યાન આપું તેમાં કશુ ખોટું નથી.

ભૂતકાળમાં અમારી કે ટ લાક ની જતીય સતામણી થએલી પણ અમે કોઈને કહેતાં ન હતાં. આ ભયંકર વાતને જૂથમાં જ અમે કહી શક્યા.



- \* આવેશાત્મક પ્રતિક્રિયા પર અંકુશ. જૂથના સભ્યો તેને સમસ્યા પ્રત્યે જાતે વિચાર કરવા પ્રેરશો. જેથી તે આવેશમાં આવીને અવિચારી નિર્ણય લેશે નહીં.



જૂથમાં બીજનું દણિબિંદુ જેતાં શીખ્યાં. જેથી બીજ જે રીતે વાત રજુ કરે છે તેની સમજણું આવી. પોતાની લાગણીથી બીજની વાત સમજવાને બદલે તેની રજુઆત સમજતાં આવડચું. તેથી ઘ્યાલ આવ્યો કે પરસ્પર સંબંધોમાં લોકો કેમ ઝઘડે છે.

- \* કારણો સમજશે. જૂથમાં ચર્ચા થવાથી બેનોને ઘ્યાલ આવે છે કે પોતાના જેવી સમસ્યા બીજાને પણ થાય છે અને વાતચીત કરવાથી પ્રશ્નનાં મૂળ કારણો શોધી શકાય છે.

હું એમ માનતી કે કુટુંબની કોઈપણ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું. અમારા દુઃખ, ગરીબી અને સંજોગોની વિગતવાર વાત કરવાથી થએલી ચર્ચામાંથી ખબર પડી કે આમાં મારો તો કોઈ વાક નથી. વળી ચર્ચામાંથી એ પણ ઘ્યાલ આવ્યો કે આપણે સ્ત્રીઓ શા માટે વધુ દુઃખી થઈએ છીએ.



- \* ઉપાયો સૂચવો. પોતે એકલી વિચારીને નિર્ણય લે એના કરતાં સમૂહે ચર્ચા દ્વારા સૂચવેલા ઉપાયો વધુ સ્વીકાર્ય હોય છે.

ભૂતકાળમાં કેટલીય વાતો આપણે આપણા જેડીદાર સાથે કરી જ નથી. જૂથમાં ચર્ચા કર્યા પછી ખબર પડી કે તેને સારી રીતે ઉકેલી શકાય એમ છે. જૂથમાં બીજી બેનો સાથે વાતચીત કરવાથી આપણી તાકાત વધે છે એમ લાગ્યું.

તેના પતિનો મરણનો દાખલો લેવા અને જગીન તેના નામ પર કરવા અમે તેની સાથે જવાનું ગોઠવ્યું. જે આ તેને એકલીને કરવાનું હોત તો ભારે પડત.



- \* સંઘર્ષકિત ઉભી થશે. એકલા કરતાં જૂથમાં બધાં સાથે કામ કરે તેની શકિત વધારે હોય છે.

## માનસિક સ્વાસ્થ્ય

૫.૪ મદ્દદ કેવી રીતે કરવી તે શીખવાનો મહાવરો.

દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે સહાયકૃપ સંબંધો કોને કહેવાય અને તે કેવી રીતે ઉપયોગી થાય છે. આ માટે જૂથના સભ્યો નીચે પ્રમાણે અનુભવ લે તે જરૂરી છે.

૧. સહારાના અનુભવોની આપ-લે. સહારો કોને કહેવાય તે સમજવા જૂથના સભ્યો પોત-પોતાના ભૂતકાળના આવા અનુભવોની વાતો કરે. તેમને મળેલી મદ્દદ કેવા પ્રકારની હતી, તે કેવી રીતે મળી, વિગેરે ચર્ચાથી આ અંગે સૌની સમજણા સ્પષ્ટ થાય.



૨. જૂથ સંચાલક અન્ય વ્યક્તિઓના અનુભવોની વાર્તા બનાવીને કહે, સમસ્યા અંગે સ્પષ્ટતા કરે અને પોતાનો સમૂહ આ સંલેગોમાં શું કરી શકે અથવા એક વ્યક્તિ જાતે શું કરી શકે તે માટે ચર્ચામાંથી ઉપાય શોધી શકાય.



ધારી બેનોને ભરત-ગૂંથણ જેવાં કામ કરતા કરતા સાંભળવાનું અને સમજવાનું વધુ ફાવે છે.

૩. સક્રિય રીતે સાંભળવાનો મહાવરો. આખો સમૂહ બળબેની જેડીમાં વહેંચાઈ જય. દરેક જેડીમાં એક વ્યક્તિ ૫-૧૦ મિનિટ બોલે. બીજુ વ્યક્તિ માત્ર સાંભળે. વચ્ચે વિક્ષેપ ના નાખે. બોલનારને પોતાના હવબાવથી પ્રોત્સાહન આપે. જરૂર પડ્યે ઢૂંકા/એકાશરી શબ્દોથી બોલનારને ઘ્યાલ આપો કે પોતે તેની વાત બરાબર સાંભળી રહ્યા છે. આવું કરવાથી વાતમાં વિક્ષેપ નાંખ્યા વગર બોલનારને પ્રોત્સાહન મળે છે. તેના પછી બીજુ વ્યક્તિ આ રીતે પોતાની વાત કહેશે. આમ કરવાથી બધાને વારાફરતી બોલવાનો અને સાંભળવાનો મહાવરો મળશે.



ત્યારબાદ સક્રિય રીતે સાંભળવું એટલે શું તેની ચર્ચા કરો. તમને સાંભળવાનું ગમ્યું ? તમને શું મુશ્કેલીઓ હતી ? ત્યારબાદ જૂથ સંચાલક જૂથમાં ચર્ચા કરીને સક્રિય રીતે સાંભળવું એટલે શું એ અંગે વાતચીત કરે. દા.ત. સાંભળવું એટલે બહેનોની વાત સાંભળીને તે અંગે રસ દાખવવો, જરૂર પડ્યે પ્રશ્નો પૂછવા, અનુભવોની આપ-લે કરવી અને બહેનને તમે સમજ્યા છો કે નહીં તેનો ઘ્યાલ આપવો.

**પ.૪ માનસિક સમસ્યાનું જૂથ દ્વારા નિરાકરણ :**

એકવાર જૂથની બહેનોને એકબીજાને સહારો આપવાની પ્રેક્ટીસ થઈ જય પછી કોઈ એક-બે બહેનોની માનસિક સમસ્યા પર ધ્યાન દેવું. જૂથ દ્વારા માનસિક સમસ્યા કેવી રીતે નિવારવી તેના સૂચનો :

1. જૂથમાં લાગણીઓ અને અનુભવોની આપ-લે કરો : માનસિક સમસ્યાઓવાળા લોકો એકલતા અનુભવતા હોય છે. આ સંભેગોમાં એ પોતાનો પ્રશ્ન બીજાને કહેતા થાય એ વાત જ ખૂબ ઉપયોગી થાય છે. એક પછી એક બધી વ્યક્તિઓ પોતપોતાના અનુભવો કહી રહે પછી આ બધા પ્રશ્નો પર સામાન્ય વાત શું છે એ શોદ્ધી કઢાય. આ સમસ્યા સામાજિક સંભેગોમાંથી ઉભી થઈ હતી કે કેમ તેની વિચારણા કરી શકાય અને જે એમ હોય તો આ જૂથ તેમાં શું કરી શકે તે નક્કી કરી શકાય.
2. પરિસ્થિતિમાંથી હળવાશ મેળવો : તનાવથ્રસ્ત લોકોને આ ખૂબ ઉપયોગી થાય છે. કોઈ એકાંતવાળા સ્થળે બધાં મળો. જૂથ સંચાલક બધાંને નીચે મુજબ કરવા સૂચના આપે.
- \* આંખો બંધ કરો. તમને જે બહુ જ ગમે એવી સલામત જગ્યા કોઈ ટેકરી કે પર્વત, ખેતર કે દરીયા કિનારે, તમે ગયા છો એવી કલ્પના કરો. નાકથી ઊંડો શ્વાસ લો અને મોં વાટે બહાર કાઢો.
- \* હકારાતમક વિચાર રાખો કે “હવે હું સલામત છું” “હવે મારા મનમાં શાંતિ છે”.
- \* શ્વાસ લે-મૂક કરો. આ અભ્યાસ ૨૦ મિનિટ સુધી કરો.

હળવા થવાના આ અભ્યાસ દરમ્યાન તમને બીક લાગે કે વિચિત્ર લાગણી થાય તો આંખો ખોલો અને ઊંડા શ્વાસ લો.



## માનસિક સ્વાસ્થ્ય

આ અભ્યાસનો મહાવરો સામાન્ય સંજોગોમાં પણ કરી શકાય. ઉંઘ ના આવતી હોય ત્યારે કે બીક લાગતી હોય કે તાણ અનુભવાતી હોય ત્યારે તેનાથી ખૂબ સારું લાગશે. ઉંડા શ્વાસ લેવાથી ઉત્સેલિત લાગણીઓ શાંત થાય છે અને રાહત મળે છે.

### ૩. વાર્તા કે નાટક બનાવો : જૂથના સભ્યોના

અનુભવોને વાચા આપતી વાર્તા બનાવાય. જૂથ સંચાલક પોતાની વાત કહેવાની શડ કરે. બીજા તેને વારાફરતી આગળ વધારે. સાથે સાથે કેટલાક અભિનય પણ કરે અથવા ચિત્ર પણ બનાવી શકે. પછી ચર્ચા શડ થાય.



- \* આ વાર્તામાં કયા અનુભવો કે લાગણીઓ મહત્વનાં છે ?
- \* આવી લાગણીઓ શા માટે જન્મી ? \* તેના જીવનમાં સમતુલા જળવવા શું થઈ શકે ?
- \* આ લાગણીઓનો સામનો વ્યક્તિઓએ કેવી રીતે કર્યો ?
- \* સમાજ આમાં શું કરી શકે ?

### ૪. સમાજનું ચિત્ર બનાવો : બહેનોને તેમના સમાજનાં બે

ચિત્રો દોરવાનું કહેવું. (૧) માનસિક રીતે તંદુરસ્ત સમાજ અને (૨) માનસિક રીતે બિમાર સમાજ. જૂથ સંચાલક સાદુ ચિત્ર દોરે. બીજા એ પૂરું કરે. આ ચિત્ર જેઠિને સમાજના માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉકલવા અંગે જૂથના સભ્યો સામૂહિક રીતે વિચાર કરે. જૂથ સંચાલક સમસ્યાના વિવિધ પાસાંઓ ઉપર સભ્યોનું ધ્યાન દોરાય

તેવી રીતે પ્રશ્નો પૂછી શકે.  
એ અંગે પરિવર્તનાં  
લાવવામાં જૂથકેવી રીતે  
મદદ કરી શકે તે બાબત  
બહેનો પાસેથી જ ચર્ચા  
કરાવો અને તેમ કરવા  
પ્રેરણા આપો.

ચિત્રોને અનુરૂપ ચર્ચા કરી  
બેનોને જે તે સમસ્યા  
અંગે દાખિકોણ કેળવવામાં  
મદદ કરો.



પ. ૬ આધાત પિડીત સ્વીઓને મદદ કરવી.

- \* આધાતવાળી સ્વીઓને બીજ પર વિશ્વાસ રાખતાં શીખવવું મહત્વનું છે. તેની સાથે નિયમિત સમય ગાળવાથી આ વિશ્વાસ ઉભો થશે.
- \* આ ઘટના બની તે પહેલાંનું જીવન અને વર્તમાન અનુભવો વિશે એ વાત કે તો તેને લાભ થશે. જે એને એવું લાગશે કે પહેલાં અને આજે પોતે તો એની એ જ છે. તો તેનું જીવન જલ્દી હળવું બની શકશે.
- \* આ ઘટના બની તે પહેલાંની તેની મનગમતી પ્રવૃત્તિઓ ચાલુ કરવા સમજલો. ચિત્રકામ, ભરત-ગૂંથણા, વાંચન કે માલીશ જેવી ભૌતિક પ્રવૃત્તિઓ દુઃખદ ઘટનાઓની લાગણીઓને હળવી કરે છે અથવા ભૂતાવી હે છે.
- \* જે સ્વી આધાતના કારણે સ્વપ્નમાં પણ બીતી હોય તો તેના હાલના જીવનમાંથી કોઈ વસ્તુ સાથે રાખીને સૂઈ જય તો પોતે સલામત છે એવું તેને લાગશે.
- \* જે આધાતની બીકને લીધે તે બીજ સાથે પણ સામાન્ય વર્તન ના કરી શકતી હોય તો તેની સાથે મળી તેને માનસિક રીતે તૈયાર કરો. દા.ત. તે પોતાની જાતને વારંવાર કહે કે “આ માણસનો ચહેરો જેણો મારા પર હુમલો કરેલો તે માણસના ચહેરા જેવો જ છે. પણ તે બીજ વ્યક્તિ છે એ મને ઇજન નહીં કરે”.
- \* જે કોઈ સ્વીને રિબાવવામાં આવી હોય કે તેની જતીય સત્તામણી થઈ હોય તો એને સમજલો કે જે બન્યું તેમાં એ પોતે ગુનહેગાર નથી. વાંક બીજ પક્ષનો હતો. એને સમજલો કે પેલાનો ઇરાદો તેને કાયમ માટે બોલતી બંધ કરવાનો હતો. પણ જે એ હિંમત રાખશે તો પેલો ફાવશે નહીં. હિંમતપૂર્વક મજ્જમતાથી પરિસ્થિતિનો સામનો કરવાથી સ્વીનું તેમ જ તેના કુટુંબીઓનું જીવન વધુ સ્વસ્થ બને છે.



એકવાર સ્વી પોતાની પ્રતિક્રિયાઓ સમજે પછી તેના પર લાગણીઓનો કાબુ ઓછો થાય છે.

આરોગ્ય કાર્યકરો તથા તેના સમાજના આગેવાન બેનો આધાત-પિડીત સ્વીને સહાનુભૂતિથી સાંભળીને મદદ કરી શકે છે.

**પ.૭ વ્યક્તિને આત્મહત્યા કરતાં રોકવી :**


જે તીવ્ર હતાશામાં જીવે છે તેને માટે આત્મહત્યાનું જોખમ વધારે છે, એ જલ્દીથી આમ કહેશે નહીં પણ તમે વાત કાઢો તો એ આ સ્વીકારશે. જે તમને એમ લાગે કે તે આત્મહત્યા કરવાનું વિચારી રહી છે તો શોધી કાઢો કે :

- \* તેની પાસે આત્મહત્યા કેવી રીતે કરશે તે અંગે કોઈ યોજના છે ?
- \* આ યોજના પાર પાડવાની કોઈ તૈયારી તેણે કરી છે ? તે બીજા કોઈને સાથે લઈને આત્મહત્યા કરવાની (દા.ત. પોતાના બાળકોને) યોજના બનાવે છે ?
- \* પહેલાં કોઈ વખત તેણે આવો પ્રયત્ન કરેલો ?
- \* તેનો આ નિર્ણય દાડું કે નશીલા પદાર્થોના સેવનમાંથી આવ્યો છે ?
- \* તે તેના મિત્રો કે સગા-સંબંધીઓથી એકલી પડી ગઈ છે ?
- \* તેને આરોગ્યની કોઈ ગંભીર બિમારી છે ?
- \* તે યુવાન છે અને જીવનના ગંભીર પ્રશ્નોથી ઘેરાયેલી છે ?
- \* શું તેણે જીજુવિષા (જીવવાની ઈચ્છા) ગૂમાવી છે ?



જે કોઈ સ્વીઅે આત્મહત્યાની યોજના બનાવી છે એમ તમને ખબર પડે તો તેને તરત જ મદદ કરવી જરૂરી છે.

જે આમાંથી કોઈ પણ પ્રશ્નોનો જવાબ ‘હા’ હોય તો એ આત્મહત્યા કરે એવી સંભાવના વધારે છે. આવા સંજોગોમાં તેની સાથે નિરાંતે બેસીને વાતચીત કરો. તે પોતાની હૈયા વરાળ કાઢીને હળવાશ અનુભવશે. જે એમ થાય અથવા તમને એમ લાગે કે તે ધણી જ દુઃખી છે છતાં હજુ તેની લાગણીઓ પર તેનો કાબુ છે તો તમે વચ્ચન માંગો કે તમને કહ્યા વગર તે આવું કંઈ કરશે નહીં. જે તે આ માટે તૈયાર ન થાય તો એના પર બરાબર નજર રાખો. એના મિત્રો કે સ્વજનોને પણ આ વાતની જાણ કરો અને તેને પ્રોત્સાહિત કરવા કહો. તેને એમ કહો કે તે આત્મહત્યાનો વિચાર કરે છે તે અંગે તમે તેના બીજા અંગત મિત્રો કે સગાઓને પણ જણાવી દેવાના છો. એની આસપાસ પડેલી જોખમી વસ્તુઓ દૂર કરો. હતાશામાં દવા પણ ઉપયોગી થાય છે. તે માટે માનસિક રોગના નિષ્ણાતને મળવું જોઈએ. વળી જે તમારા વિસ્તારમાં કોઈ મનોચિકિત્સક કે મનોસામાજિક સલાહ કાર્યકર હોય તો તમે તેની પાસે દર્દનિ લઈ જાઓ અને નિયમિત સારવાર અપાવો. યાદ રાખો, દર્દીની



તકલીફ અંગે તમે જે કહેશો અથવા તેના સ્વજનો જે કહેશો તેને ડૉક્ટર મહત્વની માહિતી ગણશે અને તે મુજબ તેની સારવાર ગોઠવશે. એટલે દર્દીને ડૉક્ટર પાસે લઈ જતા પહેલા તમે વિચાર કરી લો કે તમને તેના વિશે શું શું માહિતી છે.

#### ૬.૦ વિસ્થાપિત અને નિરાશ્રીત બેનો અને માનસિક સ્વાસ્થ્ય

વિકસતા દેશોમાં બંધ બાંધવા માટે કે આણુમથક અથવા ઔદ્ઘોગિક વિકાસ માટે ધણા કુટુંબો વિસ્થાપિત થાય છે. તો કેટલીકવાર હુલ્લડો, આંતરિક જીવાળ, લડાઈ કે અન્ય હિંસક સંઘર્ષોથી બચવા માટે ધણા કુટુંબો હિજરત કરે છે. જ્યારે જ્યારે આવું બને ત્યારે આ કુટુંબની સ્ત્રીઓ પર મોટી વિપદ્ધા આવે છે. તેથી ધણી સ્ત્રીઓ પર જુદ્દી જુદ્દી અસરો જેવા ભણે છે. તેઓને માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે. જેમકે, ઊંડા દુઃખની લાગણી રહેવી કે અવાચ્ક બની જવું કે હતાશા, ચિંતા રોગ જેવા માનસિક રોગ પણ થઈ શકે છે. કેટલીક બેનો સાથે જે ભયંકર બનાવો બન્યા છે તે ભૂલી શકી નથી અને તેથી તે જ બનાવો યાદ કર્યા કરે છે. ધણીવાર તેની નજર સામે તેના સ્વજનો હિંસાનો ભોગ બન્યા હોય, એક કે તેથી વધુ સ્વજનો આવી અચાનક હિંસાને કારણે મૃત્યુ પામે કે અપંગ બની જન્ય વગેરે બનાવોની પણ તેના મનમાં વિશિષ્ટ અસરો પડે છે. આવી બેનોને જ્યારે પોતાનું ઘર કે ગામ છોડી બીજે જવું પડે છે ત્યારે તેની મનઃસ્થિતિ ડામાડોળ બને તે સ્વાભાવિક છે. કેમ્પમાં રહેતી સ્ત્રીઓ પરેશાન છે કારણકે

- \* તેનું ઘર ધૂઠી ગયું છે. \* તેને અગાઉ મળતો કુટુંબીજનોનો સહારો હવે નથી.
- \* હિંસાત્મક ઘટનાઓ તેની નજર સામે બની જન્ય.
- \* અગાઉ જેટલી સ્વતંત્રતા અને સહેલાઈથી તે કુટુંબની જવાબદારી નિભાવતી હતી તે હવે શક્ય નથી.
- \* કેમ્પમાં ભીડભાડવાળી જગ્યાએ રહેવાનું હોય છે.
- \* પોતે તો બચી ગઈ છે પણ પોતાના સ્વજનો મૃત્યુ પામ્યા છે કે હિંસાનો ભોગ બન્યા છે, તેથી ગુનાની બળવત્તર લાગણીમાં રહે છે.
- \* તેના મૃત્યુ પામેલા સ્વજનોની ઉત્તર કિયા પાર નથી પાડી શકાતી.
- \* કેમ્પમાં ખાવા-પીવાની તકલીફ હોય છે. \* કેમ્પમાં કશું જ બીજું કામ નથી.



અચાનક આવી પડેલી મુસીબત કે અન્ય કારણોસર વિસ્થાપિત થયેલ બેનો પોતાની સમસ્યાઓમાંથી માર્ગ શોધી શકે તો તેના કુટુંબની આપત્તિ ઓછી થાય છે.

તેમને મદ્દ કરવાની રીતો :

આ સ્ત્રીઓની માનસિક સમસ્યા હળવી કરવા માટે તેઓને વિવિધ પ્રવૃત્તિઓમાં રોકી રાખવી જેઠાએ અને મોકલાશથી બીજુ બેનો સાથે તેઓ વાતચીત કરી શકે તેનો મોકો આપવો જેઠાએ. સમસ્યાવાળી બેનો બીજુ બેનો સાથે ભણે તેનું ધ્યાન રાખો.

- \* એવી કોઈ સમૂહપ્રવૃત્તિ કરાવો જેમાં બીજુ બેનો સાથે તે હળી-ભળી શકે. દા.ત. અક્ષરજ્ઞાનના વર્ગો શકું કરો.
- \* બેનોનું આધાર જૂથ શકું કરી શકાય.
- \* જે શક્ય હોય તો ખેતર કે બાગકામ જેવી પ્રવૃત્તિઓમાં આ બેનોને રોકી રાખો જેથી તેમના ઘરે હતું તેવું ખુલ્લુ વાતાવરણ આ બેનોને મળી શકે.
- \* આ બેનો માટે આવકલક્ષી પ્રવૃત્તિઓ યોજ શકાય.
- \* તેમને ઉત્પાદક કૌશલ્યો શીખવા માટેના વર્ગ ચાલુ કરો.
- \* તેઓ બધા સાથે મળીને ભજન, પ્રાર્થના, સમૂહગાન કે એવી બીજુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી શકે તેવી સગવડતા આપો.
- \* તેઓ એકબીજા સાથે પ્રેમ અને વિશ્વાસ કેળવી શકે તેવા પ્રયત્નો કરવા જરૂરી છે.
- \* કેમ્પમાં બેનોની સાથે બાળકો પણ હોય છે. તેથી બાળકોની રમત-ગમત તથા અન્ય પ્રવૃત્તિઓ એવી રીતે ગોઠવો જેથી બધી બેનોને તેમાં રસ પડે.
- \* જે તેમને કે તેમના કેમ્પમાં રહેતા બીજુ સ્વજનોને નાની-મોટી શારીરિક તકલીફ હોય તો તેની સારવાર કરાવો.
- \* કેમ્પમાં રહેતા બીજુ પુલખો કે સ્ત્રીઓ વચ્ચે ઝઘડા ના થાય તેવું વાતાવરણ રચો. દા.ત. સાઢી રમત-ગમત કરાવો, સારા પુસ્તકોનું સમૂહવાંચન ગોઠવો, કોઈ વાતાંકાર કે અન્ય વકતાઓને બોલાવીને ઇતર પ્રવૃત્તિ ગોઠવવાથી કેમ્પમાં રહેતા લોકો વચ્ચે સુભેળનું વાતાવરણ જગરો. તથા પરસ્પર પ્રેમ અને વિશ્વાસ બનશો.



## ૭.૦ તમારા સમાજનું માનસિક સ્વાસ્થ્ય સુધારવાના રસ્તા

માનસિક બિમારીવાળા લોકોને શોધી કાઢો.

આવી સ્વીચ્છાને આ બિમારીનું જોખમ છે :

- \* ભૂતકાળમાં માનસિક બિમારી થઈ હોય.
- \* કુટુંબ-સમાજની હુંઝ ના હોય.
- \* કુટુંબીનું અવસાન થયું હોય અથવા કુટુંબથી અલગ થઈ હોય.
- \* હિંસા જેઠી હોય અથવા મારજૂડ થઈ હોય.



આવી બધી જ સ્વીચ્છાને માનસિક સમસ્યા નથી હોતી. પરંતુ તેની માનસિક અસ્વસ્થતાનો સંકેત આપે એવું બીજું વર્તન જોવા મળે તો તેને બરાબર ઓળખો. તેના વર્તન વિશે બીજા લોકો શું કહે છે અને તેના વર્તનમાં આ ફેરફાર કયા કારણોને લીધે થયા તે શોધી કાઢો. આવી સમસ્યાઓના મૂળ કુટુંબ કે સમાજમાં જ પડેલાં હોય છે. તેથી તેની તપાસ કરો.

પ્રશ્નો ઉકેલવાની તેની આવહતથી શરૂઆત કરો : સ્વીચ્છો પાસે પોતાના પ્રશ્નો ઉકેલવાની શક્તિ હોય જ છે. ભૂતકાળમાં તેણે આવી સમસ્યાઓ સાથે કામ પાર પાડવા જે રીત વાપરી હોય તે તેને યાદ કરાવો અને એ જ રીત આ વખતે પણ કેવી રીતે વાપરી શકાય તે સમજાવો.

તેના પારંપારિક અને સામાજિક પરિષ્યળોને સમજીને કામ કરો :

તેની સામાજિક અને સાંસ્કૃતિક પ્રણાલીઓ બરાબર જાણો. કેટલાક સમાજમાં પ્રાર્થના, પૂજન-ભજન, જેવાં ઉપાયો હોય છે તે ઉપયોગી થાય જ, એવું નથી પણ પહેલાં તે અજમાવી જુઓ. એની પ્રણાલીઓમાંથી એને કેવી રીતે બળ મળશે તે વિચારી જુઓ. જે રીતે તેનો આત્મવિશ્વાસ વધે તે રીત તેને અપનાવવા કહો. યાદ રાખો કે માનસિક સ્વાસ્થ્ય માટે કોઈ જદુઈ ઉપાયો નથી.



**માનસિક રોગની સારવારમાં સ્વીને એમ લાગે કે તેને ટેકો મળી રહ્યો છે તો જ તેની સારવાર સફળ બનશે.**

સ્વીને એમ લાગે કે તેને આશરો મજ્યો છે અને તેની કોઈ દરકાર લે છે તેનો આત્મવિશ્વાસ વધે તે રીત તેને અપનાવવા કહો.

યાદ રાખો કે આવી ખાત્રી આપે તો તેનાથી ચેતીને ચાલો. જે કોઈ આવી ખાત્રી આપે તો તેનાથી ચેતીને ચાલો.

સ્વીને એમ લાગે કે તેને આશરો મજ્યો છે અને તેની કોઈ દરકાર લે છે એ જ કોઈ પણ ઉપચારનું મહત્વનું અંગ છે. એના ઈલાજમાં એના ભિત્રો અને કુટુંબીઓને સામેલ કરો.

## માનસિક સ્વાસ્થ્ય

માનસિક રોગના દર્દી અને કુટુંબને

શી રીતે ઉપયોગી થશો ?

માનસિક રોગ તેના દર્દી, કુટુંબીજનો, સ્વજનો અને મિત્રોની પણ કસોટી કરે છે. માનસિક રોગને કારણો તેના દર્દીના વર્તન અને વ્યવહારમાં ઘણા ફેરફારો થતા હોય છે; કયાં તો એ સાવ વિમુખ બની જાય છે અથવા એનામાં ઘણી આકમકતા આવી જાય છે. આવી વખતે દર્દી પ્રત્યે સહિષ્ણુતા કેળવવી ખૂબ જરૂરી છે.

- ❖ માનસિક રોગના દર્દી અને તેના કુટુંબની મુશ્કેલી સમઝે. તેમને હૈયાધારણ આપો.
  - ❖ તમારો અભિપ્રાય ન બાંધી લેશો. એમનો કેવળ સ્વીકાર કરો. અભિપ્રાય અને અનુમાનથી અંતર પેદા થાય છે અને વ્યક્તિ તમારી મદદ માંગતા કરે છે.
  - ❖ દર્દીનિ કે તેના કુટુંબને સાંભળો અને પોતાની સમસ્યાને પહોંચી વળવા માટે આવશ્યક ગોઠવણ કરવા માટે એમને માર્ગદર્શન આપો.
  - ❖ ડૉક્ટર, મનોથીકિલ્સક, કાઉન્સેલર અને સહાયકારી જૂથની મદદ મેળવવામાં ઉપયોગી થાઓ.
  - ❖ દર્દી અને તેના કુટુંબને તમારો કિંમતી સમય આપો. એમને તરફોનો નહીં. વ્યાસ્ત હૈવાનું બહાનું આગળ ન ધરો.
- તમામ માનસિક રોગો એકત્ર બનીને લડવામાં આવે તો ઝટ કાબૂમાં આવે છે. દર્દીનિ તેના કુટુંબને સાવ નસીબના ભરોસે છોડી દેવામાં આપણી માનવતા નથી. માણસ માણસને કામ નહીં આવે તો કોઇ આ કામ કરશો ?



હતાશાની બીમારીમાંથી સાજા થઈ રહેલા દર્દીએ  
શી કાળજુઓ લેવી જોઈએ ?


હતાશાની માંદગીમાંથી સાજા થઈ રહેલા દર્દીએ પોતાનો આત્મવિશ્વાસ પુનઃસંપાદન કરવા અને પોતાની જુંદ્ગીનો હવાલો પોતાના હથમાં લેવા માટે ચોક્કસ આયોજન કરવાની જરૂર રહે છે.

- ❖ દરરોજ કરવાના કામોની યાદી બનાવો, જેમાં સૌથી મહત્વનાં કાર્યો મથાળે લખો.
- ❖ એક સાથે એક જ કામ હાથ પર લો અને એને પૂરું કરવામાં તમે મેળવેલી સિદ્ધિની નોંધ લો.
- ❖ દરરોજ થોડી હળવી કસરતો, દીર્ઘશસન અને કમિક સ્નાયુબદ્ધ શિથિલીકરણ માટે (progressive muscular relaxation) સમય ફાળવો.
- ❖ રોજ-બ-રોજના તણાવને કાબૂમાં રાખવા માટે નિયમિત વ્યાયામ કરો; રોજ ચાલવાનું રાખો.
- ❖ પૌષ્ટિક, સ્વાસ્થ્યપ્રદ આહાર લો.
- ❖ તમારી ચિંતાઓથી તમને દૂર લઈ જાય એવા શોખ કેળવો.
- ❖ સમાન અનુભવ ધરાવતા લોકો સાથે ભેગા મળીને એક જૂથ બનાવો. નિયમિત એકબીજાને મળો અને એકબીજાના અનુભવો વહેંચો.

માનસીક સ્વાસ્થ્ય જાળવવા માટે

આટલું જરૂર કરો.

૧. ભૂતકાળને ભૂલો. વર્તમાનમાં જીવતાં શીખો.
૨. સહનશીલ બનો. માફ કરતાં શીખો.
૩. ખૂબ હસો.
૪. નિષ્ક્રિય ન બનો. નવા નવા પડકારો ઝીલો.
૫. જત જતના શોખ કેળવો.
૬. બેઠાડું ન બનો. નિયમિત વ્યાયામ કરો.
૭. માઠી લાગણીઓને સંધરી ન રાખો. તેમને સ્વસ્થ રીતે વ્યક્ત કરી નાખો.
૮. નિર્સાર્થ બનીને લોકોપયોગી કામો કરો.
૯. ફરિયાદ ન કરો. જે જેવું છે તેવો તેનો સ્વીકાર કરો.
૧૦. તમારાથી કદી કોઈને ઠેસ ન પહોંચો એની સતત સભાનતા રાખો.



ગભરાટના હુમલા (panic attack) ને

નાથવા માટે શું કરશો ?

ગભરાટના હુમલા વખતે અનિયંત્રિત, ઝડપી શક્સનથી દર્દીના લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જતું હોય છે, જેનાથી એની અંગળીઓમાં થરથરાટી અને ઝણઝણાટી થવા લાગે છે. પ્લાસ્ટિકની થેલી નાક અને મોં પાસે રાખીને એમાં શ્કસન કરવાથી આ ચિહ્નોમાં તરત રાહત મળે છે. આવા શ્કસન વખતે દર્દી ઉરછ્છવાસમાં પ્લાસ્ટિકની થેલીમાં બહાર કાઢેલી હવા પુનઃ પોતાના શાસમાં લે છે, જેનાથી એના લોહીમાં અંગારવાચુની માત્રા વધતા એના હુમલા પર કાબૂ આવી જાય છે.

ગભરાટના હુમલા વખતે શાસની ગતિ અનિયમિત થવા માંડે કે તરત જ મોં આગળ પ્લાસ્ટિકની કોથળી પકડીને એમાં શાસ લેવા-મુકવાનું ચાલુ કરયું. આ રીતે દસેક વખત શાસ લીધા પણી કોથળી દૂર કરીને થોડા સામાન્ય શાસ લેવા. પણી ફરી કોથળીમાં શાસોરછ્છવાસ કરવા. હુમલા પર સંપૂર્ણ નિયંત્રણ આવતા સુધી આ પ્રમાણે કરયું.

(આપણું સ્વાસ્થ્ય અંક ૨૩૮ માંથી સાભાર)